KJ 158

ૐ

વીરાણી તા. ૧૪-૪-૪૫

જાહેર સભા
નો.
રિપોર્ટ

સ્થળ-: મોટી મોઢે-
સમય. ૧૦ થી ૧૨ાા સુધી

પ્રમુખ શ્રી. ભીમજી ભાઈ પ્રેમજી વીરાણી વાળા

શ્રી. ચુનીલાલ માવજીભાઈની દરખાસ્તથી-

શ્રી. માવજી હીરજી
[illegible] ભાઈઓ તથા બહેનો.
મે. પ્રમુખ સાહેબ ભાઈઓ [illegible] આપ સર્વે સમક્ષ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

પ્રમુખશ્રી — ૧૯૮૫ [illegible]
[illegible] ભાઈ પ્રેમજી
મે. પ્રમુખ સાહેબ [illegible] ભાઈઓ તથા બહેનો [illegible]
[illegible]
[illegible]

શ્રી [illegible]
[illegible]

ૐ

વીરાણી તા. [illegible]

જાહેર સભા નો રિપોર્ટ

સ્થળ:- [illegible]

સમય. ૧૦ થી ૧૨ [illegible]

પ્રમુખ શ્રી. [illegible] વીરાણી વાળા

શ્રી. [illegible] ની દરખાસ્તથી-

શ્રી. માવજી હીરજી

મો. પ્રમુખ સાહેબ ભાઈઓ તથા બહેનો. [illegible]

[illegible]

[illegible] — ૧૯૮૫ [illegible]

[illegible]

મો. પ્રમુખ સાહેબ [illegible] ભાઈઓ તથા બહેનો [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

(3)

KJ 160

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

(૫)

[illegible]

[illegible]

[illegible]